

## English Together

What would you do if you found a wallet full of cash?



*This is not a word-for-word transcript*

---

પ્રેઝન્ટર

હેલો એન્ડ વેલકમ, English Togetherમાં આપનું સ્વાગત છે. હું છું રિષી.....અને આજે મારી સાથે છે...

**Phil**

Hi, I'm Phil.

**Tom**

And I'm Tom. Welcome to the programme!

પ્રેઝન્ટર

આજે વાત કરવી છે 'honesty' એટલે પ્રમાણિકતાની અને 'money' એટલે પૈસા વિશે. મિત્રો, તમને જો પૈસાથી ભરેલું પાકીટ રસ્તામાં પડેલું મળે તો તમે શું કરશો? તમે એ પાકીટ રાખી લેશો? કે પછી એ જે વ્યક્તિનું છે એને પાછું આપી દેશો?

હાલમાં જ એક સર્વેક્ષણ થયું જેમાં એ જાણવાની કોશિશ થઈ કે લોકો કેટલા પ્રમાણિક છે. સર્વેક્ષણ અંતર્ગત વિશ્વનાં 16 શહેરોમાં પૈસાથી ભરેલા પાકીટ રસ્તામાં મૂકવામાં આવ્યા અને જોવામાં આવ્યું કે જે વ્યક્તિને પાકીટ મળે છે એ એના મૂળ માલિકને પરત કરે છે કે નહીં.

રશિયાનું પાટનગર મોસ્કો, બ્રાઝિલની રાજધાની રીયો ડી જાનેરો અને ફિનલેન્ડની રાજધાની હેલસિન્કી જેવાં શહેરોમાં આ સર્વેક્ષણ કરવામાં આવ્યું જેના તારણો ઘણાં રસપ્રદ છે. મિત્રો, તમને શું લાગે છે કે ત્રણેય શહેરોમાંથી સૌથી વધારે પ્રમાણિક શહેર કયું છે?

**Tom**

It depends. How much we are talking about?

**Phil**

Tom!

પ્રેઝન્ટર

અમે તમને સવાલનો જવાબ થોડી વારમાં જણાવીશું. મિત્રો, હાલમાં જ એક વ્યક્તિએ પૈસાથી ભરેલું પાકીટ એના મૂળ માલિકને પરત કર્યું. મિડીયાએ પણ વ્યક્તિની પ્રમાણિકતાની નોંધ લીધી છે. તમે પણ એ ન્યૂઝ સાંભળો.

### **News insert**

What would you do if you found a wallet full of cash - \$1,500 to be exact? Would you return it? A recent incident in California might surprise you. A teenager was seen on surveillance footage returning a wallet with \$1,500 inside. It happened outside a home in California after the young man found the wallet filled with \$1500 in cash and credit cards in the driveway of a neighbour's home, proving that there are still good people out there.

### **Tom**

\$1,500? That's a lot of money.

### **Phil**

Yes, it is! I'd be absolutely devastated if I lost that amount of money!

પ્રેઝન્ટર

I would be devastated, as well! 'Devastated' નો અર્થ થાય છે બરબાદ થવું અથવા પાતમાલ થઈ જવું.

### **Tom**

And the people who lost the wallet are probably devastated! That is so much money to lose!

### **Phil**

Yeah, but when they got it back they were probably completely thrilled! Imagine how happy they were to get their wallet back.

પ્રેઝન્ટર

Absolutely! 'Thrilled' એટલે રોમાંચિત થઈ જવું. Yes, what a relief!

### **Tom**

I think I'd be thrilled if I found that much money on the street!

### **Phil**

Really, Tom? Would you seriously think about keeping the money if you found it on the street?

**Tom**

I'd probably think about it, yeah. I mean, if someone is carrying around that much money in their wallet and they lose it, that's their fault, really! They should be more careful!

**Phil**

Ok, true, but it is quite easy to lose a wallet. I mean, we've all done it.

પ્રેઝન્ટર

Yes, I have, and I was very upset

**Tom**

Well, I haven't. I always know where my wallet is.

**Phil**

Well, then you don't know what it feels like to lose something that's valuable to you. You can feel totally heartbroken.

પ્રેઝન્ટર

Yes, especially if it contains some personal possessions that you can't replace.

“Heartbroken” નો અર્થ થાય છે એટલે ભગ્નહૃદય, હતાશ.

મિત્રો, તમને આગળ જે પ્રશ્ન કર્યો હતો કે મોસ્કો, રીયો ડી જાનેરો અને હેલસિન્કીમાંથી કયા શહેરના લોકો સૌથી વધુ પ્રમાણિક છે? મોસ્કો, રશિયા રીયો ડી જાનેરો, બ્રાઝિલ હેલસિન્કી, ફિનલેન્ડ અને જવાબ છે હેલસિન્કી, ફિનલેન્ડ

**Tom**

Oh, Phil, if only you'd lost your wallet in Helsinki, eh?!

**Phil**

Yeah, that would have been good! I might have got it back. I would have been absolutely ecstatic if that had happened.

પ્રેઝન્ટર

Me too! “Ecstatic”. Ecstatic એટલે ઊર્મિલ.

**Tom**

Do you know what would make me ecstatic?

**Phil**

What, Tom?

**Tom**

Finding your wallet.

**Phil**

Why?

પ્રેઝન્ટર

Yeah, why?

**Tom**

So then I could give it back to you.

**Phil**

Oh, Tom

પ્રેઝન્ટર

અરે વાહ ટોમ, ખૂબ સરસ વાત કરી! મિત્રો, જો તમને કોઈ વ્યક્તિનું પાકીટ રસ્તા ઉપર મળે તો તમે એને પરત કરશો? મને ખાતરી છે તમે પ્રમાણિકતાનું ઉદાહરણ પુરું પાડશો.

ફેંડ્સ, કોઈ વસ્તુ ખોવાઈ જવાથી તમને 'heartbroken' નો અનુભવ થયો છે? કોઈની ખોવાયેલ વસ્તુ એને પાછી આપીને તમે 'thrilled' થયા છો?

લાગણીઓ સાથે સંલગ્ન આજે જે પણ શબ્દો વિશે ચર્ચા કરી એનું પુનરાવર્તન કરી લઈએ.

'Devastated' એટલે બરબાદ થવું અથવા પાચમાલ થઈ જવું, જ્યારે "heartbroken" નો અર્થ થાય છે ભગ્નહૃદય, હતાશ.

'Thrilled' ને ગુજરાતીમાં કહીશું રોમાંચિત અને 'ecstatic' ને કહીશું ઊર્મિલ. મિત્રો, આ શબ્દો

'extreme adjective' એટલે અતિશય વિશેષણ છે. આનો અર્થ થયો કે તમે આ વિશેષણોને બીજા શબ્દો જેમ કે 'totally' એટલે પૂર્ણતયા, 'absolutely' એટલે સંપૂર્ણપણે, 'completely' એટલે સર્વથા, બિલકુલ સાથે જોડીને ઉપયોગમાં લઈ શકો છો.

આવા જ બીજા રસપ્રદ ટોપિક્સ સાથે ફરીથી મળીશું બીજા એપિસોડમાં ત્યાં સુધી ...Bye!